

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ હતા. ઉક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણી ( એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને General કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ?) ને અંતે નીચે દર્શાવેલ સંવર્ગોમાં પ્રાથમિક રીતે લાયક ગણવાપાત્ર ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ - OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે.

અ.નં.	જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	પરીક્ષાની સંભવિત તારીખ
૧	૧૭૬/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (પ્લાસ્ટીક ગ્રુપ)	૩૧/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૨	૧૬૭/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મીકેનિકલ ગ્રુપ)	૦૪/૦૮/૨૦૧૯ સવારે: ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાકે
૩	૧૬૮/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ફેબ્રિકેશન ગ્રુપ)	૦૪/૦૮/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૪	૧૭૦/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રિકલ ગ્રુપ)	૧૧/૦૮/૨૦૧૯ સવારે: ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાકે
૫	૧૭૭/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કોમ્પ્યુટર ગ્રુપ)	૧૧/૦૮/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે

નોંધ:- ઉપર દર્શાવેલ પરીક્ષાઓ પૈકી જાહેરાત ક્રમાંક ૧૬૭/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મીકેનિકલ ગ્રુપ) ની પરીક્ષા ગાંધીનગર અને અમદાવાદ ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવશે. જ્યારે અન્ય જાહેરાત/ સંવર્ગોની પરીક્ષા માત્ર ગાંધીનગર ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવામાં આવશે.

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ તેમજ રદ થયેલ અરજીપત્રકોની વિગતો (પરીક્ષા ફી ન ભરવાના કારણસર અને એક કરતાં વધુ અરજી કરેલ હોય તેવા કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક ગ્રાહ્ય રાખીને બાકીના અરજીપત્રકો ડુપ્લીકેશનના કારણસર રદ ગણવામાં આવેલ છે તેવા અરજીપત્રકોની) પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

સ્થળ:- ગાંધીનગર

તા. ૨૮/૦૬/૨૦૧૯

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,  
ગાંધીનગર